

-:: રીવીઝન ઓફ પેન્શન ::-

નાણા ખાતાના તા.૧૩-૪-૨૦૦૮ ના ઠરાવ નંબર પી.જી.આર.૧૦૦૯ / ૫ / પે સેલ [એમ]

[૧] કચેરીનું નામ :-

[૨] કર્મચારીનું નામ :-

[૩] હોદ્દો :-

[૪] નિવૃત્તિની તારીખ :-

[૫] પી.પી.ઓ.નંબર :-

[૬] જન્મ તારીખ :-

:: છેલ્લા દસ માસનો પગાર ::

અ.નં.	માસ	પે-બેન્ડ	ગ્રેડ - પે	કુલ
૧				
૨				
૩				
૪				
૫				
૬				
૭				
૮				
૯				
૧૦				
કુલ				

☐ પેન્શનપાત્ર પગાર :-

☐ $\frac{\text{સરેરાશ પગાર} \times \text{નોકરીના વર્ષ}}{૨ \times ૩૩} = \text{પેન્શન રૂ.}$

☐ છેલ્લા પગારના ૫૦ % મુજબ પેન્શન રૂ.
મૂળ પેન્શન રૂ. :-
રીવાઇઝ પેન્શન રૂ. :-
તફાવત રૂ. :-

☐ મૃત્યુ સહ નિવૃત્તિની ગ્રેજ્યુઇટીની ગણતરી :

[ક] $\frac{[\text{છેલ્લા પગાર} + \text{મોંઘવારી}] \times \text{નોકરીના વર્ષ}}{૨}$

[ખ] નોકરી દરમિયાન અવસાન થયું હોય તેવા કિસ્સામાં :

છેલ્લા પગાર + મોંઘવારી = કુલ પગાર × નોકરીના વર્ષ

.....+..... ×.....

કુટુંબ પેન્શન :

ગ્રેજ્યુઇટી રૂ.

[ક] નોકરી દરમ્યાન મૃત્યુ થયું હોય તો :

- છેલ્લા પગાર પે બેન્ડમાં પગાર = કુલ રૂ..... = રૂ.....
- ઉંચા દરે કુટુંબ પેન્શન કર્મચારીના અવસાનની તારીખથી દસ વર્ષ સુધી ૫૦% ના ઉંચા દરે તાથી સુધી કુ.પેન્શન રૂ.

નિવૃત્તિ પછી અવસાન પામતા પેન્શનરની નિવૃત્તિની તારીખ થી ૭ વર્ષ કે ૬૫ વર્ષની ઉંમરે પહોંચે આ બે પૈકી જે વહેલું હોય ત્યાં સુધી છેલ્લા પગારના ૩૦% મુજબ કુટુંબ પેન્શન

છેલ્લા પગાર પે બેન્ડમાં પગાર રૂ. ના ૩૦% =

રૂ. + રૂ. = ના ૩૦% =

તા. થી સુધી રૂ. [મહત્તમ] તા.

થી સુધી રૂ. [લઘુત્તમ]

રૂપાંતરિત પેન્શન :-

મૂળ પેન્શન રૂ. ના ૪૦% = રૂ.

રૂપા.પેન્શનની રકમ રૂપા.પેન્શન રૂ. × ૮.૩૭૧ × ૧૨ = રૂ.

કુલ રૂ. [ચૂકવવા પાત્ર કમ્પ્યુટેશન]

મુળ પેન્શન રૂ.

રૂપાંતરિત પેન્શન રૂ.

ઘટાડેલ પેન્શન રૂ.

ગ્રેજ્યુઇટી

ચૂકવવા પાત્ર રકમ રૂ.

અગાઉ ચૂકવેલ રકમ રૂ.

તફાવત રૂ.

રૂપાંતરિત પેન્શનની રકમ

ચૂકવવા પાત્ર રકમ રૂ.

અગાઉ ચૂકવેલ રકમ

રૂ.

તફાવત

રૂ.

આચાર્યશ્રીની સહી

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
પાટણ, જિલ્લો પાટણ